



Seat No. : _____

TH-112

May-2013

B. Com. (Sem.-I)**CE 101 (A) Financial Accounting I (Adv. Acc. & Auditing)**

Time : 3 Hours]

[Max. Marks : 70

1. (અ) પી, ક્યુ અને આર, 3 : 2 : 1ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તા. 1-4-2012ના રોજ તેઓએ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. તે દિવસે પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું :

7

જવાબદારી	₹	મિલકતો	₹
મૂડી : પી 48,000		કાયમી મિલકતો	1,70,000
ક્યુ 30,000		ચાલુ મિલકતો	29,000
આર 25,000	1,03,000	(₹ 7,000 રોકડ સહિત)	
લેણદારો	60,000	નફા-નુકસાન ખાતું	6,000
સામાન્ય અનામત	12,000		
તારણવાળી લોન	30,000		
	2,05,000		2,05,000

મિલકતોના નીચે મુજબ ઉપજ્યા :

₹

પ્રથમ હપ્તો	20,000
બીજો હપ્તો	50,000
ત્રીજો હપ્તો	25,000
ચોથો હપ્તો	12,000
પાંચમો હપ્તો	16,000
છઠ્ઠો હપ્તો	42,000

હપ્તાની રકમ જેમ જેમ મળતી જાય તેમ વહેંચવાનું નક્કી કર્યું.

મૂડી વધારાની રીતે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો.

અથવા

- (અ) ટૂંકનોંધ લખો : રોકડની હપ્તે-હપ્તે વહેંચણીની મહત્તમ નુકસાની રીત.

7

(બ) પટેલ બ્રધર્સનો ચાલુ ધંધો તા. 1 એપ્રિલ 2011ના રોજથી ખરીદી લેવા માટે તા. 30મી સપ્ટેમ્બર 2011ના રોજ રાજવી લિ.ની સ્થાપના કરવામાં આવી. તા. 31મી માર્ચ 2012ના રોજ પૂરા થતા વર્ષ માટે નોંધણી પહેલાં અને નોંધણી પછીના સમયનો નફો કે નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો :

- (i) વર્ષનું કુલ વેચાણ ₹ 9,00,000 હતું જે પૈકી તા. 30-9-2011 સુધીનું વેચાણ ₹ 3,00,000 હતું.
(ii) વર્ષનો કાચો નફો ₹ 4,50,000 હતો.
(iii) નફા-નુકસાન ખાતે જમા કરેલ આવક નીચે મુજબ હતી :
શેર ફેરબદલી ફી ₹ 2,000.
રોકાણો પર વ્યાજ ₹ 6,000.
(iv) નફા-નુકસાન ખાતે ઉધારેલ ખર્ચા નીચે મુજબ હતા :

	₹
પગાર	10,000
દેવાદારોને આપેલ વટાવ	3,000
જાહેરાત ખર્ચ	6,000
ડાયરેક્ટર ફી	5,000
પ્રાથમિક ખર્ચા	10,000
છપામણી-સ્ટેશનરી	7,000
ચૂકવેલ ભાડું	9,000
જાવક માલ ગાડાભાડું	4,500
ખરીદ કિંમત પર વ્યાજ	2,000
(ખરીદ કિંમતની ચૂકવણી તા. 1-7-2011ના રોજ કરેલ)	

અથવા

(બ) નોંધણી પહેલાંના નફાના ઉપયોગો સમજાવો અને તેની હિસાબી અસરો દર્શાવો. 7

2. (અ) સાંઈ લિમિટેડે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 10નો તેવા 20%ના પ્રીમિયમ જાહેર જનતામાં બહાર પાડ્યા. શેરદીઠ રકમ નીચે મુજબ ચૂકવવાની હતી : 7

અરજ સાથે ₹ 5

મંજૂરી વખતે ₹ 5 (પ્રીમિયમ સહિત)

પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે : બાકીની રકમ

કંપનીને 25000 શેર માટે અરજીઓ મળી અને બધા જ અરજદારો વચ્ચે બધા જ શેરોની પ્રમાણસર ફાળવણી કરવામાં આવી.

સીમાએ તેના 500 શેર પર મંજૂરી અને હપ્તાની રકમ ભરી નહીં અને તેના શેર જપ્ત કરવામાં આવ્યા.

આમાંથી 300 શેર ફરીથી ₹ 9ના ભાવે બહાર પાડવામાં આવ્યા.

કંપનીના ચોપડે નીચેના અંગે આમ નોંધ લખો :

- (i) શેર જપ્તી
(ii) શેર ફરી બહાર પાડવા
(iii) જપ્તી ખાતું બંધ કરવા.

અથવા

(અ) સંભવિત ઈક્વિટી શેર (Potential Equity Shares) અને સ્વેટ ઈક્વિટી શેરનો ખ્યાલ સમજાવો. 7

- (બ) કોઈપણ એક પર ટૂંકનોંધ લખો : 7
- (i) વટાવથી શેર બહાર પાડવા.
- (ii) બુક બિલ્ડીંગ પ્રક્રિયા
- (iii) શેરની પુનઃ ખરીદી (Buy back of shares)

3. (અ) પ્રેફરન્સ શેર પરત કરવા અંગે કંપની ધારાની કલમ 80ની જોગવાઈઓ જણાવો. 7

અથવા

- (અ) તા. 31-3-2012ના રોજ ગીતા લિ.ના ચોપડે નીચેની બાકીઓ હતી : 7
- 50,000 ઈક્વિટી શેર, દરેક ₹ 10 નો તેવા પૂર્ણ ભરપાઈ
- 20,000, 12% ના પ્રેફરન્સ શેર, દરેક ₹ 10નો તેવા, શેરદીઠ ₹ 8 ભરપાઈ
- જામીનગીરી પ્રીમિયમ ₹ 30,000
- સામાન્ય અનામત ₹ 1,00,000
- નફા-નુકસાન ખાતું (જમા બાકી) ₹ 50,000
- કંપનીએ પ્રેફરન્સ શેરો 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. આ હેતુસર ઓછામાં ઓછા ઈક્વિટી શેર, દરેક ₹ 10 નો તેવા ભાવોભાવ બહાર પાડવામાં આવ્યા.
- પ્રેફરન્સ શેર પરત કરવા અંગે જરૂરી આમનોંધો લખો.

- (બ) બોનસ શેર એટલે શું ? બોનસ શેરના પ્રાપ્તિસ્થાનો જણાવી તે અંગે આમનોંધ આપો. 7

અથવા

- (બ) તા. 31-3-2012ના રોજ અમર લિમિટેડના ચોપડે નીચેની બાકીઓ હતી : 7
- 30,000 ઈક્વિટી શેર, દરેક ₹ 10 નો તેવા, શેરદીઠ ₹ 8 મંગાવેલ અને ભરપાઈ
- ₹**
- | | |
|-----------------------------|----------|
| જામીનગીરી પ્રીમિયમ | 1,00,000 |
| સામાન્ય અનામત | 2,00,000 |
| મૂડી અનામત | 40,000 |
| નફા-નુકસાન ખાતું (જમા બાકી) | 1,50,000 |
- બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નીચે મુજબ બોનસ આપવાનું ઠરાવ્યું :
- (i) અધૂરા ભરપાઈ શેર પૂર્ણ ભરપાઈ કરવા માટે બોનસ
- (ii) 1 : 1ના પ્રમાણમાં પૂર્ણ ભરપાઈ ઈક્વિટી શેર બોનસ તરીકે.
- કંપનીના ચોપડે જરૂરી આમનોંધો લખો.

4. (અ) કંપનીના ઉભા વાર્ષિક હિસાબોમાં નીચેની બાકીઓ કેવી રીતે દર્શાવશો ?

8

- બાકી હપ્તા
- પાઘડી
- પ્રાથમિક ખર્ચા
- શેર ફેરબદલી ફી
- સંશોધન અને વિકાસ ખર્ચા
- કરવેરાની જોગવાઈ (ગયા વર્ષની)
- ટેલિફોન ડિપોઝીટ
- સૂચિત ડિવિડન્ડ (ગયા વર્ષનું)
- મળેલો મૂલ્ય વધિત કર (Value Added Tax collected)
- મૂડી અનામત
- ઘૂટા ભાગો
- કામદાર નફા-ભાગ ભંડોળ
- જામીનગીરી પ્રીમિયમ
- ખરીદ પરત
- વાહનો
- ડિબેન્યર પરત અનામત રોકાણોનું વ્યાજ

(બ) તા. 31-3-2012ના રોજ પૂરા થતા વર્ષના ઉભા વાર્ષિક હિસાબોમાં નીચેની માહિતી કેવી રીતે દર્શાવશો ?

6

01-04-2011ના રોજની બાકીઓ

વિગત	ઉધાર (₹)	જમા (₹)
કરવેરાની જોગવાઈ	—	50,000
સૂચિત ડિવિડન્ડ	—	30,000
અગાઉથી ચૂકવેલ કરવેરા	10,000	—
નફા-નુકસાન ખાતું	—	80,000

ચાલુ વર્ષ 2011-12 દરમ્યાન ગયા વર્ષની આવકવેરાની આકારણી પૂરી થયેલ અને કરવેરાની જવાબદારી ₹ 60,000 નક્કી થયેલ.

ચાલુ વર્ષ દરમ્યાન ₹ 68,000 અગાઉથી કરવેરાના ચૂકવેલ હતા.

ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડ પૈકી ₹ 20,000 ચાલુ વર્ષે ચૂકવેલ હતા. ચાલુ વર્ષ માટે કરવેરા ₹ 1,00,000 અને સૂચિત ડિવિડન્ડ ₹ 70,000 ની જોગવાઈ કરવાની છે.

અથવા

4. નીચે આપેલ કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી કંપનીધારા, 1956ની અનુસૂચી-VI મુજબ ઉભા સ્વરૂપમાં વાર્ષિક હિસાબો તૈયાર કરો :

14

તા. 31-3-2012ના રોજનું 'Y' લિમિટેડનું કાચું સરવૈયું

ઉધાર બાકી	₹	જમા બાકી	₹
જમીન	37,250	ઈકિવટી શેર મૂડી	2,00,000
મકાન	1,50,000	(દરેક ₹ 10 નો તેવા શેર)	
પ્લાન્ટ	80,000	સામાન્ય અનામત	80,000
ફર્નિચર	15,000	જામીનગીરી પ્રીમિયમ	20,000
વેચાણ ખર્ચ	12,000	વેચાણ	3,02,250
ડિરેક્ટર ફી	2,400	આવકવેરાની જોગવાઈ	15,000
વહીવટી ખર્ચ	38,000	(2010-11)	
ડૂબત નિધિ રોકાણો	40,800	ઘાલખાદ પરત	1,500
બાકી હપ્તા	3,000	6%ના ડિબેન્ચર	2,00,000
ઘાલખાદ	2,000	નફા-નુકસાન ખાતું	5,000
દેવાદારો	1,45,000	(1-4-2011)	
ઓડીટ ફી	1,000	ડૂબત નિધિ	40,800
અગાઉથી ચૂકવેલ આવકવેરો (2010-11)	12,000	લેણદારો	23,000
અગાઉથી ચૂકવેલ આવકવેરો (2011-12)	8,000	ડૂબત નિધિની રોકાણોનું વ્યાજ	2,500
આખર સ્ટોક	65,000	વટાવ	3,000
રોકડ અને બેંક	73,600	ચૂકવવાનો બાકી પગાર	4,000
વ્યવસ્થિત ખરીદી	2,00,000		
ડિબેન્ચર વ્યાજ	12,000		
	8,97,050		8,97,050

વધારાની માહિતી :

- (i) ગયા વર્ષની આવકવેરાની આકારણી ચાલુ વર્ષે પૂરી થયેલ અને કરવેરાની જવાબદારી ₹ 14,000 નક્કી થઈ.
- (ii) ચાલુ વર્ષે નફાના 40% લેખે કરવેરાની જોગવાઈ કરવાની છે.
- (iii) પ્લાન્ટ અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો.

5. દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

14

- (1) નોંધણી પહેલાંનો નફો _____ ખાતે લઈ જવામાં આવે છે.
(A) સામાન્ય અનામત (B) નફા-નુકસાન
(C) મૂડી અનામત (D) મૂડી
- (2) લેણદારો પાસેથી મળેલ વટાવ નોંધણી પહેલાં અને પછીના સમય વચ્ચે _____ ને આધારે વહેંચવામાં આવે છે.
(A) ખરીદી (B) વેચાણ
(C) દેવાદારો (D) લેણદારો
- (3) જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડ્યા બાદ શેર જપ્તી ખાતાની બાકી _____ ખાતે લઈ જવામાં આવે છે.
(A) સામાન્ય અનામત (B) મૂડી અનામત
(C) નફા-નુકસાન (D) શેર જપ્તી
- (4) શેર જપ્ત કરવામાં આવે ત્યારે _____ ઉધારવામાં આવે છે.
(A) જપ્ત કરેલ શેર પર મળેલ જામીનગીરી પ્રીમિયમ
(B) જપ્ત કરેલ શેર પર નહિં મળેલ જામીનગીરી પ્રીમિયમ
(C) જપ્ત કરેલ શેર પર આપેલ વટાવ
(D) જપ્ત કરેલ શેર પર શેરહોલ્ડરે ભરેલ રકમ
- (5) પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, કંપની માટે _____ છે.
(A) આવક (B) ખોટ
(C) અનામત (D) આમાંથી કોઈ નહિ
- (6) અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, પૂર્ણ ભરપાઈ કરવા માટે _____ નો ઉપયોગ કરી શકાય નહિ.
(A) જામીનગીરી પ્રીમિયમ (B) સામાન્ય અનામત
(C) નફા-નુકસાન ખાતું (જમા બાકી) (D) આમાંથી કોઈ નહિ

- (7) પાકા સરવૈયામાં જામીનગીરી પ્રીમિયમ _____ તરીકે નોંધાયા છે.
 (A) આવક (B) મિલકત
 (C) જવાબદારી (D) અનામત અને વધારો
- (8) સંભવિત ઈકિવટી શેર એ _____ શેર છે.
 (A) કંપનીએ બહાર પાડેલ
 (B) સામાન્ય પ્રજાને શેર ખરીદવા આમંત્રણ આપેલ
 (C) નજીકના ભવિષ્યમાં બહાર પાડવામાં આવનાર
 (D) જપ્ત કરેલ
- (9) શેરની પુનઃખરીદી બાદ કુલ ભરપાઈ થયેલ મૂડીમાં _____ થાય છે.
 (A) વધારો (B) ઘટાડો
 (C) અસર થતી નથી (D) આમાંથી કોઈ નહિ
- (10) બોનસ શેર આપ્યા બાદ કંપનીની અનામતોમાં _____ થાય છે.
 (A) વધારો (B) ઘટાડો
 (C) અસર થતી નથી (D) આમાંથી કોઈ નહિ
- (11) જપ્ત કરેલ શેર ફરી બહાર પાડતાં કંપની વધુમાં વધુ _____ વટાવ આપી શકે છે.
 (A) કોઈ મર્યાદા વગર
 (B) 10%
 (C) જપ્ત કરેલ શેર પર મળેલ મૂડીની રકમ
 (D) આમાંથી કોઈ નહિ
- (12) રોકડની હપ્તે-હપ્તે વહેંચણીમાં _____ રીતમાં ભાગીદારોને સૌથી વધારે રોકડ મળે છે.
 (A) મૂડી વધારાની (B) મહત્તમ નુકસાનની
 (C) બંને (D) આમાંથી કોઈ નહિ
- (13) ભાડે પટ્ટે મિલકત એ _____ છે.
 (A) કાયમી મિલકત (B) ચાલુ મિલકત
 (C) અદૃશ્ય મિલકત (D) અવાસ્તવિક મિલકત

(14) પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ _____ છે.

- (A) નફા-નુકસાન ખાતામાં નોંધાતી આવક
 - (B) પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય
 - (C) પાકા સરવૈયામાં રોકાણોમાં ઉમેરાય
 - (D) નોંધ થતી નથી.
-

TH-112

May-2013

B. Com. (Sem.-I)**CE 101 (A) Financial Accounting I (Adv. Acc. & Auditing)**

Time : 3 Hours]

[Max. Marks : 70

1. (a) P, Q and R are partners sharing profit or loss in the ratio of 3 : 2 : 1. on 1-4-2012 they decided to dissolve partnership. Balance Sheet of the firm on this date was as under :

Liabilities	₹	Assets	₹
Capital : P 48,000		Fixed Assets	1,70,000
Q 30,000		Current Assets	29,000
R <u>25,000</u>	1,03,000	(including cash ₹ 7,000)	
Creditors	60,000	Profit and Loss A/c	6,000
General Reserve	12,000		
Mortgaged Loan	30,000		
	2,05,000		2,05,000

Assets realized as under :

	₹
First instalment	20,000
Second instalment	50,000
Third instalment	25,000
Fourth instalment	12,000
Fifth instalment	16,000
Sixth instalment	42,000

It was decided to distribute the instalments as and when realized.

Prepare statement showing piecemeal distribution of cash by surplus capital method.

OR

- (a) Write short note on : Maximum loss method of piecemeal distribution of cash. 7
- (b) Rajvi Ltd. was incorporated on 30th September, 2011 to take over running business of Patel Brothers from 1st April, 2011. 7

From the following information calculate profit or loss during pre and post incorporation period for the year ending on 31st March, 2012.

- (i) Sales during the year was ₹ 9,00,000 out of which sales upto 30th September 2011 was ₹ 3,00,000.

- (ii) Gross profit for the year ₹ 4,50,000.
- (iii) Incomes credited to Profit and Loss A/c. were as under :
Share transfer fee ₹ 2,000.
Interest on Investment ₹ 6,000.
- (iv) Expenses debited to Profit and Loss A/c. were as under :

	₹
Salaries	10,000
Discount allowed to Debtors	3,000
Advertisement expenses	6,000
Directors fees	5,000
Preliminary expenses	10,000
Printing and Stationery	7,000
Rent Paid	9,000
Carriage outward	4,500
Interest on purchase consideration	2,000

(Purchase Consideration was paid on 1st July, 2011)

OR

- (b) Explain uses of Profit Prior to incorporation and state its accounting entries. 7

2. (a) Sai Ltd. issued 20,000 Equity Shares to General Public of ₹ 10 each at 20 % Premium. The amount payable per share was as under : 7

On application ₹ 5

On allotment ₹ 5 (including premium)

On first and final call : Balance Amount

The company received applications for 25,000 shares and all shares were allotted on pro-rata among all applications.

Seema failed to pay allotment and call money on 500 shares and her shares were forfeited.

300 shares out of these were reissued at ₹ 9 per share.

Pass Journal Entries in the books of the company regarding

- (i) Forfeiture of shares
(ii) Re-issue of shares
(iii) Closure of forfeited shares account

OR

- (a) Explain the concept of potential Equity Shares and Sweat Equity Shares. 7

- (b) Write short note on any **one** : 7
- (i) Shares issued at discount
 - (ii) Book building process
 - (iii) Buy back of shares

3. (a) State provisions of section 80 of Companies Act for redeeming preference shares. 7

OR

- (a) Following were Balances of Gita Ltd. as on 31-3-2012. 7

50,000 Equity Shares of ₹ 10 each, fully paid up 20,000, 12% Preference Shares of ₹ 10 each, ₹ 8 per share paid up.

Security premium ₹ 30,000

General Reserve ₹ 1,00,000

Profit and Loss A/c (Credit balance) ₹ 50,000

The company decided to redeem preference shares at 10% premium, for this purpose Company issued minimum Equity Shares ₹ 10 each of par.

Pass necessary Journal entries for redeeming Preference Shares.

- (b) What is Bonus shares ? State sources of Bonus Shares and give Journal Entries for issue of bonus shares. 7

OR

- (b) Following were the balances of Amar Ltd. as on 31-3-2012. 7

30,000 Equity Shares of ₹ 10 each, ₹ 8 per share called up and paid up.

₹

Security Premium 1,00,000

General Reserve 2,00,000

Capital Reserve 40,000

Profit and Loss A/c. (Credit Balance) 1,50,000

The board of directors decided to issue bonus shares as under :

- (i) To make partly paid up shares fully paid up.
- (ii) To issue fully paid Equity Shares as bonus in the ratio of 1 : 1.

Pass necessary Journal Entries for bonus shares.

4. (a) State how you record following balances in Vertical final accounts of a company. **8**

- Calls in Arrears
- Goodwill
- Preliminary expenses
- Share Transfer fee
- Research and Development expenses
- Provision for Taxation (Last year)
- Telephone Deposit
- Proposed dividend (Last year)
- Value Added Tax collected
- Capital Reserve
- Loose Tools
- Workers Profit Sharing Fund
- Security Premium
- Purchase Return
- Vehicles
- Interest on Debenture Redemption Fund investment

(b) How will you show following in vertical final accounts of a company for the year ended 31-3-2012. **6**

Balances as on 01-04-2011

Particulars	Debit (₹)	Credit (₹)
Provision for taxation	–	50,000
Proposed dividend	–	30,000
Advance payment of tax	10,000	–
P & L A/C.	–	80,000

Income Tax assessment for the last year was completed during the current year 2011-12 and tax liability was decided at ₹ 60,000.

Advance payment of tax made during current year ₹ 68,000.

₹ 20,000 was paid towards proposed dividend of last year. Provision for tax to be made for current year ₹ 1,00,000 and proposed dividend for current year ₹ 70,000.

OR

4. From the following Trial Balance and Additional information prepare final accounts in vertical form as per Schedule VI of Companies Act, 1956 : 14

Trial Balance of 'Y Ltd.' as on 31-3-2012

Debit Balances	₹	Credit Balances	₹
Land	37,250	Equity Share Capital	2,00,000
Building	1,50,000	(Shares of ₹ 10 each)	
Plant	80,000	General Reserve	80,000
Furniture	15,000	Security Premium	20,000
Selling expenses	12,000	Sales	3,02,250
Director fee	2,400	Provision for income tax	15,000
Administrative expenses	38,000	(2010-11)	
Sinking Fund Investments	40,800	Bad debt recovered	1,500
Calls in Arrears	3,000	6% Debentures	2,00,000
Bad debt	2,000	Profit & Loss A/c.	5,000
Debtors	1,45,000	(1-4-2011)	
Audit fee	1,000	Sinking Fund	40,800
Income tax paid in advance for 2010-11	12,000	Creditors	23,000
Income Tax paid in advance		Interest on Sinking Fund Investment	2,500
for 2011-12	8,000	Discount	3,000
Closing Stock	65,000	Unpaid salary	4,000
Cash & Bank	73,600		
Adjusted Purchase	2,00,000		
Debenture interest	12,000		
	8,97,050		8,97,050

Additional information :

- (i) Income assessment of last year was completed during current year and final tax liability was decided at ₹ 14,000.
- (ii) Make provision for income tax for current year at 40% of profit.
- (iii) Depreciate Plant and Furniture by 5%.

5. Select most appropriate alternative from alternatives given for each question.

14

- (1) Profit prior to incorporation is transferred to _____ account.
(A) General Reserve (B) Profit & Loss
(C) Capital Reserve (D) Capital
- (2) Discount earned from Creditors is allocated to pre and post incorporation period on the basis of _____.
(A) Purchase (B) Sales
(C) Debtors (D) Creditors
- (3) Balance of forfeited Shares A/c, after reissue of Equity Shares is transferred to _____ account.
(A) General Reserve (B) Capital Reserve
(C) Profit & Loss (D) Forfeited Shares
- (4) _____ is debited when shares are forfeited.
(A) Security premium received on shares forfeited.
(B) Security premium not received on shares forfeited.
(C) Discount allowed on shares forfeited.
(D) Amount paid by shareholder on shares forfeited.
- (5) Premium on redemption of Preference Shares is _____ for the company.
(A) Income (B) Loss
(C) Reserve (D) None of these
- (6) _____ cannot be used for bonus to make partly paid up Equity Shares fully paid up.
(A) Security Premium (B) General Reserve
(C) Profit & Loss A/c. (Cr. Balance) (D) None of these
- (7) Security Premium is recorded in Balance Sheet as _____.
(A) Income (B) Asset
(C) Liability (D) Reserves & Surplus
- (8) Potential Equity Shares, are the shares _____.
(A) Issued by the company
(B) Offered for public subscription
(C) To be issued in near future
(D) Forfeited Shares

- (9) After buy back of shares, total paid up capital of the company _____.
(A) Increases (B) Reduces
(C) Not affected (D) None of these
- (10) After issue of bonus shares, Reserves of the company _____.
(A) Increase (B) Reduce
(C) Do not change (D) None of these
- (11) A company can give maximum _____ discount while re-issue of shares forfeited.
(A) Without any limit
(B) 10%
(C) Amount of capital received on shares forfeited
(D) None of these
- (12) Under _____ method of piecemeal distribution of cash, partners receive maximum cash.
(A) Capital surplus (B) Maximum loss
(C) Both (D) None of these
- (13) Leasehold Asset is _____.
(A) Fixed Asset (B) Current Assets
(C) Intangible Asset (D) Fictitious Asset
- (14) Interest received on Provident Fund Investment is _____.
(A) An income recorded in Profit and Loss Account.
(B) Added to Provident Fund in Balance Sheet.
(C) Added to Investment in Balance Sheet.
(D) Not Recorded.
-

